



**JAQ-1601250101010100** Seat No. \_\_\_\_\_

**B. A. (Sem. I) (CBCS) (W.E.F. 2016) Examination**

**November - 2019**

**Economics : Paper - I**

*(Principles of Economics - I)*

*(Core) (Old Course)*

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70]

- સૂચના :** (૧) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના ઉત્તરો આપો.  
 (૨) જમણી બાજુના અંક જે તે પ્રશ્નના પૂરા ગુણ દર્શાવે છે.  
 (૩) જરૂર જ્ઞાય ત્યાં આહૃતિનો ઉપયોગ કરો.

૧	અર્થશાસ્ત્રના નિયમોનું સ્વરૂપ સમજાવો. <b>અથવા</b>	૧૪
૧	અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સંવિસ્તર સમજાવો.	૧૪
૨	પ્રો.લાયોનલ રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. <b>અથવા</b>	૧૪
૨	માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની કુલ ખર્ચની રીત અને ટકાવારીના ફેરફારની રીત સમજાવો.	૧૪
૩	અર્થશાસ્ત્રનું સ્વરૂપ સંવિસ્તર સમજાવો. <b>અથવા</b>	૧૪
૩	ઘટતા સીમાંત તૃષ્ણિગુણના નિયમ દ્વારા ગ્રાહકની સમતુલ્ય સમજાવો.	૧૪
૪	માંગની મૂલ્યસાપેક્ષતાના પ્રકારો સમજાવો. <b>અથવા</b>	૧૪
૪	પ્રો. એડમ સિમથે આપેલ અર્થશાસ્ત્રની સંપત્તિલક્ષી વ્યાખ્યા સમજાવો તેની ભર્યાદાઓ જ્ઞાવો.	૧૪
૫	ટૂંકનોંધ લખો : (કોઈપણ બે) (૧) પ્રો. માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. (૨) માંગની આવક્સાપેક્ષતાનો ઘ્યાલ. (૩) માંગની મૂલ્યસાપેક્ષતાનો અર્થ અને વ્યાખ્યા. (૪) કુલ તૃષ્ણિગુણ અને સીમાંત તૃષ્ણિગુણનો ઘ્યાલ.	૧૪

## ENGLISH VERSION

### Instructions :

- (1) Answer all the question on the basis of internal option.
- (2) Right side figure indicate full marks of the question.
- (3) Draw the diagram wherever necessary.

1 Explain the nature of economics laws. 14

**OR**

1 Explain the scope of Economics in detail. 14

2 Explain the definition of economics given by Prof. Lionel Robbins. 14

**OR**

2 Explain the total cost method and the percentage change method for measuring the elasticity of demand. 14

3 Explain the nature of Economics in detail. 14

**OR**

3 Explain the consumer equilibrium with the help of law of diminishing marginal utility. 14

4 Explain the types of elasticity of demand. 14

**OR**

4 Explain wealth definition of economics, given by Prof. Adam Smith. Give its limitations. 14

5 Write short notes : (any two) 14

- (1) The definition of economics given by Prof. Marshall
- (2) The concept of income elasticity.
- (3) The meaning and definition of elasticity of demand.
- (4) The concept of total utility and marginal utility.

